



RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY



Shri Chimanbhai Patel Vikas Bhavan Post Box No. 238, Jambagar Road, Rajkot

નં.- રૂડા/ટેક/ડી.બી./ઝોન સર્ટી./દ્વિ.પુ.વિ.યો./૩૯ ગામો/૭૩૦

તા. ૨૫-૦૫-૨૦૧૬

પ્રતિ

શ્રી સંસ્કાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર ઓફ

શૈલેષભાઈ લાખાભાઈ સિદપરા વિગેરે

C/o. સૌરભ પટેલ (એડવોકેટ)

પ્રસંગ હોલની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગ રોડ,

રાજકોટ.

વિષય :- ઝોનીંગ સર્ટીફિકેટ આપવા અંગે.

સત્તામંડળ (રૂડા) ની દ્વિતીય મુસદ્દારૂપ પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ અન્વયે.

સંદર્ભ :- આપશ્રીની તા. ૨૧-૦૫-૨૦૧૬ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે આપશ્રીની તા. ૨૧-૦૫-૨૦૧૬ ની અરજીમાં નિર્દિષ્ટ વિસ્તાર/સાથે સામેલ નકશા મુજબ મોજે - મવડી તાલુકો - રાજકોટ ના રેવન્યુ સર્વે નં.- ૧૦૮ અંતિમ ખંડ નં.- ૨૯ પ્લોટ નં.- ૬ થી ૧૨ ની જમીન ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૧૭ અન્વયે સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના જાહેરનામા નં.- જી.એચ./વી/૨૪ ઓફ ૨૦૦૪/ડી.વી.પી./૧૩૨૦૦૧/૨૨૬૨/એલ તા. ૨૦-૦૨-૨૦૦૪ અન્વયે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની મંજૂર કરાયેલ પુનરાવર્તિત વિકાસ યોજનાની દરખાસ્ત મુજબ રહેણાંક ઝોન માં સૂચિત કરાયેલ છે અને સર્વે નંબરની પૂર્વે ૪૫.૦ મીટર ચપ્પોઝડ ડી.પી. રસ્તાની કપાત થાય છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૬ હેઠળ તા. ૦૩-૧૧-૨૦૧૫ નાં રોજ મંજૂરી હેઠળ સરકારશ્રીમાં સાદર કરેલ દ્વિતીય મુસદ્દારૂપ પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ મુજબ સદરહુ જમીન એગ્રીકલ્ચર ઝોન માં સૂચિત કરાયેલ છે અને તેમજ સર્વે નંબરની પૂર્વે હયાત રસ્તો પસાર થાય છે.

(૧) સદરહુ જમીન મોજે - મવડી ટી.પી.સ્કીમ નં.- ૨૧ વિસ્તારમાં આવતી હોવાથી તેને ટી.પી.સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો/જોગવાઈઓ લાગુ પડશે અને ફેરફારને પાત્ર રહેશે.

ખાસ નોંધ:-

(૧) આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે. વિકાસ/બાંધકામની પરવાનગી નથી.

(૨) દ્વિતીય મુસદ્દારૂપ પુનરાવર્તિત વિકાસ યોજનાની દરખાસ્તો સત્તામંડળ દ્વારા આયોજન થયા મુજબ અને સરકારશ્રી દ્વારા આખરી મંજૂર થયા મુજબ ફેરફારને પાત્ર રહેશે.

જુનિયર નગર નિયોજક

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ

રાજકોટ

DRAFT DEVELOPMENT PLAN 2031 A.D.(SECOND REVISED)

~~TRUE COPY~~

JUNIOR TOWN PLANNER
RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY
RAJKOT